

માધ્યમિક વિભાગની વર્ગ મંજૂરી અંગેના ધારાધોરણો

બિન સરકારી માધ્યમિક નવા/ક્રમિક વર્ગવધારા મંજૂર કરવા માટે સરકારશ્રીના અસ્તિત્વ ધરાવતાં સબંધિત ઠરાવોની જોગવાઈઓને ધ્યાને નીચે મુજબના નોર્મ્સ ધ્યાને લેવામાં આવશે.

- શિક્ષણ વિભાગના તા. ૮/૩/૨૦૧૧ના ઠરાવ અનુસાર શાળાના દરેક ધોરણના માન્ય વર્ગમાં શિક્ષણ વિભાગના તા. ૩૧/૧૨/૨૦૦૯ના ઠરાવની જોગવાઈ-૧ અને ૨ મુજબ ૬૦ વિદ્યાર્થી રજીસ્ટર સંખ્યા હોવી જોઈએ. એક એક વર્ગ ધરાવતી શાળા માટે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીસંખ્યા ૨૪ અને શહેર વિસ્તારમાં ૩૬ હોવી જોઈએ.
- ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં જે તે ધોરણના દરેક વધારાના વર્ગ માટે નીચેના ટેબલમાં કોલમ-૩ અને ૪માં દર્શાવ્યા મુજબ લઘુત્તમ વિદ્યાર્થીઓની રજિસ્ટર્ડ સંખ્યા ધ્યાને લેવામાં આવશે.

ક્રમ	વર્ગ	શહેરી વિસ્તાર માટે (ઉદાહરણ)	ગ્રામ્ય વિસ્તાર માટે (ઉદાહરણ)
૧	પ્રથમ	૩૬	૨૪
૨	બીજો	૬૦+૩૬=૯૬	૬૦+૨૪=૮૪
૩	ત્રીજો	૬૦+૬૦+૩૬=૧૫૬	૬૦+૬૦+૨૪=૧૪૪
૪	ચોથો	૬૦+૬૦+૬૦+૩૬=૨૧૬	૬૦+૬૦+૬૦+૨૪=૨૦૪
૫	પાંચમો	૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૨૭૬	૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૨૬૪
૬	છઠ્ઠો	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૩૩૬	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૩૨૪
૭	સાતમો	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૩૯૬	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૩૮૪
૮	આઠમો	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૪૫૬	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૪૪૪
૯	નવમો	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૫૧૬	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૫૦૪
૧૦	દસમો	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૩૬=૫૭૬	૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૬૦+૨૪=૫૬૪
આ મુજબ આગળના ક્રમ માટે પણ			

- વિશિષ્ટ પ્રકારની શાળાઓ માટે અંધ, અંધ અને અંપગ શાળાઓ માટે સરાસરી હાજરીનું ધોરણ નીચે મુજબ છે.

(ક) અંધ શાળા માટે એક વર્ગમાં ઓછામાં ઓછી ૧૦ (દસ) વિદ્યાર્થી સંખ્યા હોવી જોઈએ, એટલે કે ૧૦ વિદ્યાર્થીએ એક વર્ગનું પ્રમાણ રાખવાનું રહેશે.

(ખ) વધારાના વર્ગ માટે નીચે પ્રમાણે વધુ સંખ્યા થાય તો જ નવો વર્ગ શરૂ કરવાનો રહેશે.

- | | | |
|-----|---------------------|-----------------------|
| (૧) | ૧૦ થી ૧૫ વિદ્યાર્થી | ૦૧ વર્ગ (પહલો વર્ગ) |
| (૨) | ૧૬ થી ૨૫ વિદ્યાર્થી | ૦૨ વર્ગ (બીજો વર્ગ) |
| (૩) | ૨૬ થી ૩૫ વિદ્યાર્થી | ૦૩ વર્ગ (ત્રીજો વર્ગ) |
| (૪) | ૩૬ થી ૪૫ વિદ્યાર્થી | ૦૪ વર્ગ (ચોથો વર્ગ) |

- શાળાના મંજૂર થયેલ દરેક વર્ગોમાં પ્રવેશ માટે નિયત થયેલ વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈ ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિદ્યાર્થી પ્રવેશ સંખ્યા સામે ગ્રામ્ય વિસ્તાર માટે ૫૫ ટકા અને શહેર વિસ્તાર ૮૦ ટકા દૈનિક સરાસરી હાજરી જળવાતી હોવી જોઈશે.
- શાળા પાસે નીચે મુજબની ભૌતિક સુવિધાઓ હોવી જોઈશે.

- વર્ગખંડોની જોગવાઈ- દરેક વર્ગખંડનું ક્ષેત્રફળ મા.શિ. વિનિમય નં. ૯(૧૩)(૨)ની જોગવાઈઓ મુજબ ઓછામાં ઓછું ૪૦૦ ચો.ફૂટ અને વિદ્યાર્થી દીઠ ૬ચો.ફૂટ જાળવવાનું રહેશે.
- વર્ગખંડોમાં લાઇટ પંખાની પર્યાપ્ત સુવિધા
- પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.
- આરોગ્ય વિષયક સગવડો પર્યાપ્ત હોવી જોઈએ.
- સી.સી.ટી.વી. કેમેરા તથા ફાયર સેફ્ટી અંગેની વ્યવસ્થા.
- શાળાના મકાન અંગે બી.યુ.પરમીશનનાં પ્રમાણપત્ર/મકાનના સ્ટ્રક્ચરલ એન્જીનીયરીંગનું પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
- રમતગમતના મેદાન અંગે શિક્ષણ વિભાગના તા.૪/૫/૦૯ના પત્રથી આપેલ સુચનાનુસાર વર્ગવધારો મંજૂર કરતી વખતે શાળાની નોંધણી સમયે રજૂ કરેલ મેદાનના આધારો ધ્યાને લેવામાં આવશે.
- તમામ વિદ્યાર્થીઓને રમત ગમત માટે મેદાન ઉપલબ્ધ થાય તે માટે આચાર્યશ્રીએ કરેલ તાસ ફાળવણીની વિગતો
- જે તે ધોરણના છ થી વધુ વર્ગોની મંજૂરી અન્વયે શિક્ષણ વિભાગના તા.૪/૭/૨૦૧૨ના ઠરાવની જોગવાઈ મુજબ બોર્ડનું પરિણામ ૭૫% કરતાં વધુ હોવું જોઈશે જે ધ્યાને લઈ વર્ગ મંજૂર કરી શકાશે.
- વર્ગવધારા અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્થળ તપાસના જિલ્લા શિક્ષણાધિકારીનો અભિપ્રાય ધ્યાને લેવામાં આવશે.
- ઉપરોક્ત નોર્મ્સ ઉપરાંત કમિશનર શાળાઓની કચેરીની કમીટી ધ્વારા વર્ગવધારો મંજૂર/નામંજૂર કરવા અંગે વિવેકાધિન નિર્ણય કરવામાં આવશે.
- વધુમાં વર્ષ : ૨૦૧૯-૨૦ વર્ષ માટે જે તે વિસ્તારમાં મંજૂર થયેલ બજેટ જોગવાઈની મર્યાદામાં વર્ગોને મંજૂરી આપવામાં આવશે.
- જે તે વિસ્તારમાં મંજૂર કરવાપાત્ર વર્ગોની સંખ્યા વધુ હોય ત્યારે નીચે મુજબના નોર્મ્સને ધ્યાને લઈ, મેરીટ તૈયાર કરી અગ્રતાક્રમ મુજબ વર્ગોની મંજૂરી આપવામાં આવશે.
- જે ધોરણનો વર્ગ માંગેલ હોય તેની કુલ વિદ્યાર્થી સંખ્યા + ગત વર્ષનું ધો-૧૦નું પરિણામ
- લઘુમતી શાળાઓને પણ ઉપરોક્ત ધોરણો લાગુ પડશે.